

7 לְשֵׂאת מְגוּרֵיהֶם יְכַלֶּה אֶרֶץ וְלֹא יִחְדְּוּ מִשְׁכַּבְתָּם רַב רְכוּשָׁם הָיָה כִּי- 7
 समाववा तेमना-वसवाटनी भूमि शक्ति अने-नछेती साथे साथे रडेवा-माटे घशी तेमनी-संपत्ति छती कारेश-डे
[H5375](#) [H4033](#) [H0776](#) [H3201](#) [H3808](#) [H3427](#) [H7399](#) [H1961](#)

אָהָם מִפְּנֵי מְקוֹנֵיהֶם :
 तेमने कारेशे तेमने
[H4735](#) [H6440](#) [H0853](#)

For their substance was too great for them to dwell together; and the land of their sojournings could not bear them because of their cattle.

8 וַיָּשָׁב וַיֵּשֶׁב בְּהַר עֵשָׂו אֶדְוֹם :
 अने-वस्यो अने-वस्यो एसाव एसाव सेरना सेरना
[H0123](#) [H1931](#) [H6215](#) [H2022](#) [H6215](#) [H3427](#)

And Esau dwelt in mount Seir: Esau is Edom.

9 וְאֵלֶּה תְּלֻדֹתָיו בְּהַר עֵשָׂו אֶדְוֹם :
 अने-आ अने-आ अदोमना पिता एसावनी एसावनी
[H2022](#) [H0123](#) [H0001](#) [H6215](#) [H8435](#) [H0428](#)

And these are the generations of Esau the father of the Edomites in mount Seir:

10 אֵלֶּה שְׁמוֹת בְּנֵי-עֵשָׂו אֲלִיפָז עֵשָׂו אֶדְוֹם :
 आ अने-आ अदोमना एसावनी एसावनी एसावनी एसावनी
[H7467](#) [H6215](#) [H0802](#) [H5711](#) [H0464](#) [H6215](#) [H8034](#) [H0428](#)
 אֲשֶׁת עֵשָׂו אֲשֶׁת עֵשָׂו אֶדְוֹם :
 एसावनी एसावनी एसावनी एसावनी
[H6215](#) [H0802](#) [H1315](#)

these are the names of Esau's sons: Eliphaz the son of Adah the wife of Esau, Reuel the son of Basemath the wife of Esau.

11 וַיְהִיו וַיְהִיו וַיְהִיו וַיְהִיו :
 अने-छता अने-छता सङ्गे ओमार तेमान अलीङ्गना एकराओ अने-छता
[H7073](#) [H1609](#) [H6825](#) [H0201](#) [H8487](#) [H0464](#) [H1961](#)

And the sons of Eliphaz were Teman, Omar, Zepho, and Gatam, and Kenaz.

12 וַתִּמְנַע וַתִּמְנַע וַתִּמְנַע וַתִּמְנַע :
 अने-तिमना अने-तिमना एसावनी एसावनी एसावनी एसावनी
[H6002](#) [H0853](#) [H0464](#) [H3205](#) [H6215](#) [H0464](#) [H6370](#) [H1961](#) [H8555](#)
 אֵלֶּה בְּנֵי עֵשָׂו אֶדְוֹם :
 अ एसावनी एसावनी एसावनी एसावनी
[H6215](#) [H0802](#) [H5711](#) [H0428](#)

And Timna was concubine to Eliphaz Esau's son; and she bare to Eliphaz Amalek: these are the sons of Adah, Esau's wife.

13 וְאֵלֶּה בְּנֵי רְעוּאֵל בְּנֵי רְעוּאֵל :
 अने-आ अने-आ एसावनी एसावनी एसावनी एसावनी
[H1315](#) [H1961](#) [H0428](#) [H4199](#) [H8048](#) [H2226](#) [H5184](#) [H7467](#) [H0428](#)
 אֲשֶׁת עֵשָׂו אֲשֶׁת עֵשָׂו :
 एसावनी एसावनी एसावनी एसावनी
[H6215](#) [H0802](#)

And these are the sons of Reuel: Nahath, and Zerah, Shammah, and Mizzah: these were the sons of Basemath, Esau's wife.

עֵשָׂו	אִשְׁתּוֹ	זַבְעוֹן	בֵּת	עֲנָה	בֵּת	אֲהֻלִּיבָמָה	בָּנָיו	הָיוּ	וְאֵלֶּהָ	14
એસાવની	પત્ની	સિબઓનની	દીકરી	અનાહની	દીકરી	ઓહોલીબામાહના	દીકરાઓ	હતા	અને-આ	
H6215	H0802	H6649	H1323	H6034	H1323	H0173		H1961	H0428	

יְעוּשׁ	וְיָלָם	וְיָלָם	וְיָלָם	וְיָלָם	(יְעוּשׁ)	אֶת-	לְעֵשָׂו	וְיָלָם	
કોરાહ	અને	યાલામ	અને	અને	યેઉશ	—	એસાવને	અને-જન્મ-આપ્યો	
H7141	H0853	H3281	H0853	H3266	H3274	H0853	H6215	H3205	

And these were the sons of Oholibamah the daughter of Anah, the daughter of Zibeon, Esau's wife: and she bare to Esau Jeush, and Jalam, and Korah.

אֶלְדָּר	תִּימָן	אֶלְדָּר	עֵשָׂו	בְּכוֹר	אֶלְיָצָר	בָּנָיו	עֵשָׂו	בָּנָיו	אֶלְדָּר	אֵלֶּהָ	15
સરદાર	તેમાન	સરદાર	એસાવના	પ્રથમજનિત	અલીફાઝના	દીકરાઓ	એસાવના	દીકરાઓના	સરદારો	આ	
H8487			H6215	H1060	H0464		H6215			H0428	

אֶלְדָּר	זֶפְחָה	אֶלְדָּר	קְנָז	
સરદાર	સફી	સરદાર	કનાઝ	
	H6825		H7073	

These are the chiefs of the sons of Esau: the sons of Eliphaz the first-born of Esau: chief Teman, chief Omar, chief Zepho, chief Kenaz,

אֶלְדָּר	אֶדְוֹם	בְּאֶרְזֵן	אֶלְיָצָר	אֶלְדָּר	אֵלֶּהָ	עַמְלֵק	אֶלְדָּר	גַּתָּם	אֶלְדָּר	קְרָח	אֶלְדָּר	16
આ	અદોમના	દેશમાં	અલીફાઝના	સરદારો	આ	અમાલેક	સરદાર	ગાતામ	સરદાર	કોરાહ	સરદાર	
H0428	H0123	H0776	H0464		H0428	H6002		H1609		H7141		

בְּנֵי	עֲדָה:
દીકરાઓ	આદાહના
	H5711

chief Korah, chief Gatam, chief Amalek: these are the chiefs that came of Eliphaz in the land of Edom; these are the sons of Adah.

אֶלְדָּר	שָׁמְחָה	אֶלְדָּר	זֶרַח	אֶלְדָּר	נַחַת	אֶלְדָּר	עֵשָׂו	בֶּן-	רְעוּאֵל	בָּנָיו	וְאֵלֶּהָ	17
સરદાર	શામ્માહ	સરદાર	ઝેરાહ	સરદાર	નાહથ	સરદાર	એસાવનો	દીકરો	રેઉએલના	દીકરાઓ	અને-આ	
	H8048		H2226		H5184		H6215		H7467		H0428	

עֵשָׂו:	אִשְׁתּוֹ	בְּשֵׁמַת	בָּנָיו	אֵלֶּהָ	אֶדְוֹם	בְּאֶרְזֵן	רְעוּאֵל	אֶלְדָּר	אֵלֶּהָ	מִצְחָה
એસાવની	પત્ની	બાસમાથના	દીકરાઓ	આ	અદોમના	દેશમાં	રેઉએલના	સરદારો	આ	મિઝહાહ
H6215	H0802	H1315		H0428	H0123	H0776	H7467		H0428	H4199

And these are the sons of Reuel, Esau's son: chief Nahath, chief Zerah, chief Shammah, chief Mizzah: these are the chiefs that came of Reuel in the land of Edom; these are the sons of Basemath, Esau's wife.

אֵלֶּהָ	קְרָח	אֶלְדָּר	יְעֻשׁ	אֶלְדָּר	יְעוּשׁ	אֶלְדָּר	עֵשָׂו	אִשְׁתּוֹ	אֲהֻלִּיבָמָה	בָּנָיו	וְאֵלֶּהָ	18
આ	કોરાહ	સરદાર	યાલામ	સરદાર	યેઉશ	સરદાર	એસાવની	પત્ની	ઓહોલીબામાહના	દીકરાઓ	અને-આ	
H0428	H7141		H3281		H3266		H6215	H0802	H0173		H0428	

אֶלְדָּר	עֵשָׂו:	אִשְׁתּוֹ	עֲנָה	בֵּת	אֲהֻלִּיבָמָה
સરદારો	એસાવની	પત્ની	અનાહની	દીકરી	ઓહોલીબામાહના
	H6215	H0802	H6034	H1323	H0173

And these are the sons of Oholibamah, Esau's wife: chief Jeush, chief Jalam, chief Korah: these are the chiefs that came of Oholibamah the daughter of Anah, Esau's wife.

אֵלֶּהָ	בָּנָיו	עֵשָׂו	וְאֵלֶּהָ	אֶלְדָּר	הוּא	אֶדְוֹם:	ס
આ	દીકરાઓ	એસાવના	અને-આ	સરદારો	તે	અદોમ	—
	H0428	H6215	H0428		H1931	H0123	

These are the sons of Esau, and these are their chiefs: the same is Edom.

20 אֵלֶּה בְּנֵי שַׁעִיר הַחֹרִי יִשְׁבִּי הָאֲרָץ לוֹטָן וְשׁוֹבָל וְצִבְעוֹן וְעֵנָה:
 આ દિકરાઓ દીકરાના સેઈરના હોરીના વસનારા દેશના લોતાન શોબાલ અને-શોબાલ અને-અનાહ અને-અનાહ
[H0428](#) [H2752](#) [H3427](#) [H0776](#) [H3877](#) [H7732](#) [H6649](#) [H6034](#)

These are the sons of Seir the Horite, the inhabitants of the land: Lotan and Shobal and Zibeon and Anah,

21 וְדִשׁוֹן וְאֶזֶר וְדִשָּׁן אֵלֶּה אֲלֻפֵּי הַחֹרִי בְּנֵי שַׁעִיר בְּאֶרֶץ אֲדוֹמִים:
 અને-દિશોન અને-એસેર અને-દિશોન આ સરદારો અલોપી હોરીના દીકરાઓ સેઈરના દેશમાં બાર્ણના અદોમના
[H1787](#) [H0687](#) [H1789](#) [H0428](#) [H2752](#) [H0776](#) [H0123](#)

and Dishon and Ezer and Dishan: these are the chiefs that came of the Horites, the children of Seir in the land of Edom.

22 וַיְהִי וַיְהִי בְּנֵי לוֹטָן חֹרִי וְהִימָם וְנָחֻת לוֹטָן תַּמְנָע:
 અને-હતા અને-હોરી હોરીના અને-હેમામ અને-હેને અનાહની લોતાનની તમના
[H1967](#) [H0269](#) [H3877](#) [H8555](#)

And the children of Lotan were Hori and Heman; and Lotan's sister was Timna.

23 וְאֵלֶּה וְאֵלֶּה בְּנֵי שׁוֹבָל עֲלוֹן וּמְנַחֵת וְעִיבָל וְשִׁפּוֹ וְאֹנָם:
 અને-આ અને-આ દીકરાઓ શોબાલના આલ્વાન આલ્વાન અને-માનાહાથ અને-એબાલ અને-ઓનામ અને-ઓનામ
[H0428](#) [H7732](#) [H5935](#) [H8195](#) [H0208](#)

And these are the children of Shobal: Alvan and Manahath and Ebal, Shepho and Onam.

24 וְאֵלֶּה בְּנֵי צִבְעוֹן וְאִיָּה וְעֵנָה הָוָא עֵנָה אֲשֶׁר מְצָא אֶת-הַיַּמִּם
 અને-આ દીકરાઓ સિબઓનના આયાહ અને-આયાહ અને-અનાહ તે અને-અનાહ એણે શોધ્યા શોધ્યા — ગરમ-ગરમ
[H0428](#) [H6649](#) [H0345](#) [H6034](#) [H1931](#) [H6034](#) [H0853](#) [H4672](#) [H0853](#) [H3222](#)

בְּמִדְבָּר אֶת-בְּרֵעֲתוֹ הַחֲמֹרִים לְצִבְעוֹן אָבִיו:
 રણમાં — ગધેડા સિબઓન પિતાના
[H0853](#) [H2543](#) [H6649](#) [H0001](#)

And these are the children of Zibeon: Aiah and Anah; this is Anah who found the hot springs in the wilderness, as he fed the asses of Zibeon his father.

25 וְאֵלֶּה בְּנֵי עֵנָה דִּישׁוֹן וְאֵהָלִיבָמָה בֵּת-עֵנָה:
 અને-આ દીકરાઓ અનાહના દિશોન અને-ઓહોલીબામાહ દીકરી અનાહની
[H0428](#) [H6034](#) [H1787](#) [H0173](#) [H1323](#) [H6034](#)

And these are the children of Anah: Dishon and Oholibamah the daughter of Anah.

26 וְאֵלֶּה בְּנֵי דִישׁוֹן חֲמֹדָן וְאֶשְׁבָּן וַיְתָרָן וְכֶרָן:
 અને-આ દીકરાઓ દીશાનના હેમદાન અને-એશબાન અને-ચિથ્રાન અને-કરાન
[H0428](#) [H1789](#) [H2533](#) [H0790](#) [H3506](#) [H3763](#)

And these are the children of Dishon: Hemdan and Eshban and Ithran and Cheran.

27 אֵלֶּה בְּנֵי אֶזֶר בִּלְהָן וְזַעֲוָן וְעָקָן:
 આ દીકરાઓ એસેરના બિલ્હાન અને-ઝાવાન અને-અકાન
[H0428](#) [H0687](#) [H1092](#) [H2190](#) [H6130](#)

These are the children of Ezer: Bilhan and Zaavan and Akan.

28 אֵלֶּה בְּנֵי דִישׁוֹן עֹזָן וְאַרָּן:
 આ દીકરાઓ દીશાનના ઊસ અને-અરાન
[H0428](#) [H1789](#) [H5780](#) [H0765](#)

These are the children of Dishan: Uz and Aran.

29 אֵלֶּה אֲלֻפֵּי הַחֹרִי אֶזֶר אֶזֶר לוֹטָן אֶזֶר אֶזֶר שׁוֹבָל אֶזֶר אֶזֶר:
 આ સરદારો હોરીના સરદાર લોતાન સરદાર શોબાલ સરદાર સરદાર સરદાર સરદાર
[H0428](#) [H2752](#) [H3877](#) [H7732](#) [H6649](#) [H6034](#)

These are the chiefs that came of the Horites: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,

בְּאֶרְזַן દેશમાં H0776	לְאֶלְפִיקָהם તેમના-સરદારો-પ્રમાણે H0776	הַחֹרִי હોરીના H2753	אֶלְיָצָבַי સરદારો H0428	אֶלְהָ આ H0428	דִּישֹׁן દીશાન H1789	אֶלְזָבָר સરદાર H0687	אֶלְזָבָר સરદાર H1787	דִּישֹׁן દીશાન H1787	אֶלְזָבָר સરદાર H1787	30
									שְׂעִיר : — સેઈરના	

chief Dishon, chief Ezer, chief Dishan: these are the chiefs that came of the Horites, according to their chiefs in the land of Seir.

יִשְׂרָאֵל : ઈસ્રાએલના H3478	לְבָנָי દીકરાઓ-પર H4428	מְלָךְ રાજાએ H4428	מְלָךְ રાજા-કર્ચુ H6440	לְבָנָי પહેલાં H0123	אֶרְזָם અદોમના H0776	בְּאֶרְזַן દેશમાં H0776	מְלָכָו રાજા-કર્ચુ H4428	אֶשְׂרָ જેઓ H4428	הַמְּלָכִים રાજાઓ H0428	וְאֶלְהָ અને-આ H0428	31
--	---	--	---	--	--	---	--	---	---	--	----

And these are the kings that reigned in the land of Edom, before there reigned any king over the children of Israel.

דִּנְהַבָּה : દિનહાબાહ H1838	עִירוֹ તેના-નગરનું H8034	וְשָׁם અને-નામ H1160	בְּעֹזַר બેઓરનો H1160	בֶּן- દીકરો H0123	בְּלָע બેલા H0123	בְּאֶרְזָם અદોમમાં H0123	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H0123	32
--	--	--	---	---	---	--	---	----

And Bela the son of Beor reigned in Edom; and the name of his city was Dinhabah.

מְבַצְרָה : બોસાહથી H1224	זֶרַח ઝેરાહનો H2226	בֶּן- દીકરો H3103	יֹבָב યોબાબ H8478	תְּחַרְתָּיו તેના-સ્થાને H8478	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H4191	בְּלָע બેલા H4191	וַיָּמָת અને-મૃત્યુ-પામ્યો H4191	33
---	---	---	---	--	---	---	--	----

And Bela died, and Jobab the son of Zerah of Bozrah reigned in his stead.

הַתֵּימָנִי : તેમાનીના H8489	מֵאֶרְזַן દેશથી H0776	חֻשָּׁם હુશામ H2367	תְּחַרְתָּיו તેના-સ્થાને H8478	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H3103	יֹבָב યોબાબ H4191	וַיָּמָת અને-મૃત્યુ-પામ્યો H4191	34
--	---	---	--	---	---	--	----

And Jobab died, and Husham of the land of the Temanites reigned in his stead.

מִדְיָן મિદ્યાનને H4080	אֶת- — H0853	הַמִּזְבָּה જેણે-હરાવ્યો H5221	בְּרָד બદાદનો H0911	בֶּן- દીકરો H1908	הַרְדָּ હદાદ H8478	תְּחַרְתָּיו તેના-સ્થાને H8478	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H2367	חֻשָּׁם હુશામ H4191	וַיָּמָת અને-મૃત્યુ-પામ્યો H4191	35	
							עֵוִית : અવીથ H5762	עִירוֹ તેના-નગરનું H8034	וְשָׁם અને-નામ H4124	מוֹאָב મોઆબના H4124	בְּשָׂרָה મેદાનમાં

And Husham died, and Hadad the son of Bedad, who smote Midian in the field of Moab, reigned in his stead: and the name of his city was Avith.

מִמְשַׁרְקָה : માસ્રેકાહથી H4957	שַׁמְלָה સામ્લાહ H8072	תְּחַרְתָּיו તેના-સ્થાને H8478	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H1908	הַרְדָּ હદાદ H4191	וַיָּמָת અને-મૃત્યુ-પામ્યો H4191	36
--	--	--	---	--	--	----

And Hadad died, and Samlah of Masrekah reigned in his stead.

הַנְּהָר : નદીના H5104	מִרְהוֹבֹת રહોબોથ-નાહારથી H7344	שָׁאֻל શાઉલ H7586	תְּחַרְתָּיו તેના-સ્થાને H8478	וַיְמָלְךָ અને-રાજા-કર્ચુ H8072	שַׁמְלָה સામ્લાહ H4191	וַיָּמָת અને-મૃત્યુ-પામ્યો H4191	37
--	---	---	--	---	--	--	----

And Samlah died, and Shaul of Rehoboth by the River reigned in his stead.

38
 וַיָּמָת שְׂאוּל וַיִּמְלֹךְ אַחֲבוֹר בֶּן-אֲחִיזָבָהל בָּן עַכְבֹּר: אֲחִיזָבָה
 અને-મૃત્યુ-પામ્યો શાઉલ અને-રાજ-કર્યું તેના-સ્થાને તેના-હાનાન બાલ-હાનાન
 H4191 H7586 H8478 H1177 H5907

And Shaul died, and Baal-hanan the son of Achbor reigned in his stead.

39
 וַיָּמָת אֲחִיזָבָהל בָּן עַכְבֹּר: וַיִּמְלֹךְ הָדָר בֶּן-חָדָד וְשֵׁם עִירוֹ פָּעוּ
 અને-મૃત્યુ-પામ્યો બાલ-હાનાન દીકરો આખ્બોરનો દીકરો તેના-સ્થાને તેના-સ્થાને હદાર અને-નામ તેના-નગરનું
 H4191 H1177 H5907 H8478 H1924 H8034 H6464
 וְשֵׁם אִשְׁתּוֹ מְהֵטָבַל בַּת-מַטְרֵד בַּת זָהָב: מִי-זָהָב
 અને-નામ તેની-પત્નીનું મહેતાબઅલ દીકરી માત્રેદની દીકરી મે-ઝાહાબની
 H8034 H0802 H4105 H1323 H4308 H4314

And Baal-hanan the son of Achbor died, and Hadar reigned in his stead: and the name of his city was Pau; and his wife's name was Mehetabel, the daughter of Matred, the daughter of Me-zahab.

40
 וְאֵלֶּה שְׁמוֹת אֲלוּפֵי עֵשָׂו לְמִשְׁפַּחָתָם לְמִקְמֹתָם בְּשִׁמְתָם אֲלוּף תִּמְנָע
 અને-આ નામો સરદારોના એસાવના તેમના-કુટુંબો-પ્રમાણે તેમના-સ્થાનો-પ્રમાણે તેમના-નામો-પ્રમાણે સરદાર
 H0428 H8034 H6215 H4940 H4725 H8034 H8555
 אֲלוּף יֶתֶת: אֲלוּף יֶתֶת: אֲלוּף יֶתֶת: אֲלוּף יֶתֶת:
 સરદાર સરદાર આલ્વાહ સરદાર
 H3509 H5933

And these are the names of the chiefs that came of Esau, according to their families, after their places, by their names: chief Timna, chief Alvah, chief Jetheth,

41
 אֲלוּף אֶהֱלִיבָמָה אֲלוּף אֵלָה אֲלוּף פִּינּוֹן:
 સરદાર ઓહોલીબામાહ સરદાર સરદાર સરદાર
 H0173 H0425 H6373

chief Oholibamah, chief Elah, chief Pinon,

42
 אֲלוּף קְנָז אֲלוּף תֵּמָן אֲלוּף מִבְּצָר:
 સરદાર કનાઝ સરદાર તેમાન સરદાર મિબ્સાર
 H7073 H8487 H4014

chief Kenaz, chief Teman, chief Mibzar,

43
 אֲלוּף מַגְדִּיֵּל אֲלוּף עִירָם אֲלוּף אִירָם אֲלוּף אִירָם
 સરદાર માગ્દીઅલ સરદાર ઈરામ સરદાર ઈરામ સરદાર
 H4025 H5902 H0428 H0123 H0776 H0272
 הָאָבִי עֵשָׂו: פִּ— אֲבוֹתָם: אֲבוֹתָם: אֲבוֹתָם:
 તે એસાવ પિતા અદોમનો અદોમનો અદોમનો
 H1931 H6215 H0001 H0123

chief Magdiel, chief Iram: these are the chiefs of Edom, according to their habitations in the land of their possession. This is Esau, the father of the Edomites.